

SARDAR PATEL UNIVERSITY
B. Com. (I Semester) (NC 2010 Batch) Examination
2016
Friday, 21st October
2.00 pm - 4.00 pm
UB01CCOM04/12 - Accounting for Firms

કુલ ગુણ : ૬૦

- નોંધ:** (૧) જમણી તરફના અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.
 (૨) જરૂરી તમામ ગણતરીઓ દર્શાવો.

- પ્ર.૧ રામ અને ભરત અનુક્રમે રૂ.૧૦૦ પ્રમાણમાં નફો-નુકશાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તેમની પેઢીનું (૧૫) તા. ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે:

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
મૂડી ખાતા:		મકાન	૮૦૦૦
રામ ૧૬૦૦૦		ફર્નિચર	૨૪૦૦
ભરત ૧૨૦૦૦	૨૮૦૦૦	સ્ટોક	૪૮૦૦
સામાન્ય અનામત	૯૬૦૦	દેવાદારો	૩૦૦૦૦
લેણદારો	૬૪૦૦	હાથ પર રોકડ	૪૮૦૦
બેન્ક ઓવરડ્રાફ્ટ	૬૦૦૦		
	૫૦૦૦૦		૫૦૦૦૦

લક્ષ્યને નીચેની શરતોને આધીન ભાગીદારીમાં દાખલ કરવાનું નક્કી કર્યું :

- લક્ષ્ય મૂડી તરીકે રૂ. ૪૮૦૦ રોકડા અને પાઘડી તરીકે રૂ. ૩૬૦૦ લાવશે જે ધંધામાં રોકી રાખવામાં આવશે.
 - લક્ષ્ય નફા-નુકશાનમાં ૧/૪ ભાગ મેળવવા હકદાર રહેશે.
 - રૂ. ૯૦૦ શકમંદ લેણાની જોગવાઈ કરવી.
 - ફર્નિચર પર ૫% ઘસારો ગણવાનો છે.
 - સ્ટોકની પુનઃ આંકણી કિંમત રૂ. ૪૨૦૦ ગણવાની છે.
- તૈયાર કરો:** ૧. નફા-નુકશાન હવાલા ખાતું
 ૨. ભાગીદારોનાં મૂડી ખાતાં
 ૩. નવી પેઢીનું પાકું સરવૈયું

અથવા

પ્ર.૧

- (અ) 'અ' અને 'બ' ૩:૨ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચી લેતા ભાગીદારો છે. તેઓ 'ક' ને ભાગીદાર તરીકે દાખલ કરે છે. પેઢીની પાઘડીની કિંમત રૂ. ૩૬૦૦૦ આંકવામાં આવી. 'ક' તેના હિસ્સાની પાઘડી રોકડમાં લાવે છે. 'અ', 'બ' અને 'ક'નું નવું પ્રમાણ અનુક્રમે ૫:૨:૨ રાખવામાં આવે છે. પેઢીના ચોપડામાં જરૂરી આમનોંધ આપો. (૦૭)
- (બ) 'એક્સ' અને 'વાય' અનુક્રમે રૂ. ૧૩૦૦૦૦ અને રૂ. ૯૦૦૦૦ મૂડી ધરાવતા ભાગીદારો છે. 'ઝેડ'ને નફામાં ૧/૫ ભાગ આપી તેઓ ભાગીદાર તરીકે દાખલ કરે છે. 'ઝેડ' મૂડી તરીકે રૂ. ૮૦૦૦૦ રોકડા લાવે છે. પાઘડી અંગે જરૂરી આમનોંધ આપો. (૦૮)

પ્ર.૨ રવિ, કિરણ અને ઉષા અનુક્રમે ૩:૨:૧ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચી લેતા ભાગીદારો છે. પેઢીનું તા. ૩૧-૧૨-૨૦૧૫ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું:

(૧૫)

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
લેણદારો	૧૩૬૦૦	રોકડ	૪૭૦૦
મૂડી ખાતાં:		દેવાદારો	૮૦૦૦
રવિ ૧૫૦૦૦		સ્ટોક	૧૧૭૦૦
કિરણ ૧૦૦૦૦		મકાન	૨૩૦૦૦
ઉષા ૧૦૦૦૦	૩૫૦૦૦	નફા-નુકશાન ખાતું	૧૨૦૦
	૪૮૬૦૦		૪૮૬૦૦

ઉપરોક્ત તારીખે કિરણ નીચેની શરતોએ નિવૃત્ત થાય છે :

૧. મકાનની કિંમત રૂ. ૭૦૦૦ થી વધારવી.
૨. દેવાદારો પર ૫% શકમંદ લેણાંની જોગવાઈ કરવી.
૩. પેઢીની પાઘડીની કિંમત રૂ. ૧૮૦૦૦ આંકવામાં આવી અને આ અંગેનો હવાલો ચાલુ ભાગીદારોના મૂડી ખાતે, પાઘડીનું ખાતું ચોપડે ખોલ્યા સિવાય નાખવાનો છે.
૪. કિરણને રૂ. ૩૦૦૦ તરત જ ચૂકવી આપવાના છે અને મૂડી ખાતે રહેતી રકમ તેના લોન ખાતે લઈ જવાની છે.

તૈયાર કરો: (૧) નફા-નુકશાન હવાલા ખાતું
(૨) ભાગીદારોનાં મૂડી ખાતાં
(૩) રોકડ ખાતું
(૪) કિરણની નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું

અથવા

પ્ર.૨

(અ) 'અ', 'બ' અને 'ક' ૫:૩:૨ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. 'બ' નિવૃત્ત થાય છે. નિવૃત્ત ભાગીદારનો ભાગ 'અ' અને 'ક' ૨:૧ના પ્રમાણમાં લઈ લે છે. નફા-નુકશાનનું નવું પ્રમાણ શોધો. (૦૫)

(બ) નીચેના પર ટૂંકનોંધ લખો:

૧. નિવૃત્ત ભાગીદારની લેણી રકમની ચૂકવણી (૦૫)
૨. લાભનું પ્રમાણ (૦૫)

પ્ર.૩ 'અ' અને 'બ'નું તા. ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું:

(૧૫)

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
લેણદારો	૩૮૦૦૦	બેન્ક સિલક	૧૧૫૦૦
શ્રીમતી 'અ'ની લોન	૧૦૦૦૦	સ્ટોક	૬૦૦૦
'બ'ની લોન	૧૫૦૦૦	દેવાદારો	૧૬૦૦૦
સામાન્ય અનામત	૫૦૦૦	ફર્નિચર	૪૦૦૦
મૂડી ખાતાં:		સાંચા	૨૮૦૦૦
અ ૧૦૦૦૦		રોકાણો	૧૦૦૦૦
બ ૮૦૦૦	૧૮૦૦૦	નફા-નુકશાન ખાતું	૭૫૦૦
	૮૬૦૦૦		૮૬૦૦૦

તા. ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રોજ પેઢીનું નીચેની શરતોએ વિસર્જન કરવામાં આવ્યું:

૧. 'અ' રૂ. ૮૦૦૦માં રોકાણો લઈ લેવા અને શ્રીમતી 'અ'ની લોન ચૂકવી આપવા સંમત થાય છે.

૨. અન્ય મિલકતોના નીચે પ્રમાણે ઉપજયા:
- | | | | |
|---------|----------|----------|-----------|
| સ્ટોક | રૂ. ૫૦૦૦ | દેવાદારો | રૂ. ૧૮૫૦૦ |
| ફર્નિચર | રૂ. ૪૫૦૦ | સાંચા | રૂ. ૨૫૦૦૦ |
૩. વિસર્જન ખર્ચ રૂ. ૧૬૦૦ થયો.
૪. લેણદારો કુલ રૂ. ૩૭૦૦૦ લેવા સંમત થયા.
- ભાગીદારો ૩:૨ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે.
- તૈયાર કરો:** (૧) માલ મિલકત નિકાલ ખાતું
(૨) ભાગીદારોનાં મૂડી ખાતાં
(૩) બેન્ક ખાતું

અથવા

- પ્ર.૩ 'આઈ' અને 'વી' ૩:૨ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચતા ભાગીદારો હતા. તેમણે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો નિર્ણય કર્યો તે તારીખે તેમની મૂડી અનુક્રમે આઈ - રૂ. ૭૬૫૦, વી - રૂ. ૪૩૦૦ હતી. પેઢીના લેણદારો રૂ. ૨૭૫૦૦ હતા. હાથ પર રોકડ રૂ. ૭૬૦ હતી. તેમની મિલકતોના રૂ. ૨૫૪૩૦ ઉપજયા. વિસર્જન ખર્ચ રૂ. ૧૫૪૦ થયો. બધા જ ભાગીદારો સફર હતા.
- તૈયાર કરો:** (૧) માલ મિલકત નિકાલ ખાતું
(૨) ભાગીદારોનાં મૂડી ખાતાં
(૩) રોકડ ખાતું

- પ્ર.૪ પી, ક્યુ અને આર ૩:૨:૧ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો હતા તા. ૧લી એપ્રિલ, ૨૦૧૬ના રોજ તેમણે પેઢીનું વિસર્જન કર્યું ત્યારે તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું:

દેવાં	રૂ.	મિલકતો	રૂ.
મૂડી:			
પી	૪૦૦૦	હાથ પર રોકડ	૧૦૦૦
ક્યુ	૨૪૦૦	અન્ય મિલકતો	૬૦૦૦
આર	૮૦૦		
લેણદારો			
	૭૨૦૦		
	૨૮૦૦		
	૧૦૦૦૦		૧૦૦૦૦

નીચે મુજબના હપ્તામાં મિલકતના ઉપજયા:

- પ્રથમ હપ્તો રૂ. ૧૬૦૦
બીજો હપ્તો રૂ. ૨૬૦૦
ત્રીજો હપ્તો રૂ. ૨૪૦૦

મૂડી વધારાની રીતે ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો.

અથવા

- પ્ર.૪ (અ) નીચેના પર ટૂંકનોંધ લખો:
મહત્તમ નુકશાનની પદ્ધતિ (૦૭)
- (બ) 'આર', 'એસ' અને 'ટી'ની પેઢીના વિસર્જન વખતે દેવાં ચૂકવ્યા બાદ જુલાઈ અને ઓગસ્ટ ૨૦૧૬માં રૂ. ૪૦૦૦ અને રૂ. ૨૬૦૦૦ના બે હપ્તા મળ્યા. તેમનું નફા-નુકશાનનું પ્રમાણ અનુક્રમે ૨:૧:૨ અને તેમની મૂડી અનુક્રમે રૂ. ૩૦૦૦૦, રૂ. ૨૦૦૦૦ અને રૂ. ૩૦૦૦૦ છે.
રોકડની વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો. (૦૮)



